



## Hindustan Oil Exploration Company Limited

'Lakshmi Chambers', 192, St. Mary's Road, Alwarpet, Chennai - 600 018. INDIA.

Phone: 91 (044) 66229000 ● Fax: 91 (044) 66229011 / 66229012

E-mail: [contact@hoec.com](mailto:contact@hoec.com) ● Website: [www.hoec.com](http://www.hoec.com) CIN: L11100GJ1996PLC029880

August 19, 2025

By Online

<b>The Listing Department</b> <b>National Stock Exchange of India Ltd.,</b> "Exchange Plaza", Bandra Kurla Complex, Bandra (East), Mumbai – 400 051 Stock Code: HINDOILEXP	<b>The Corporate Relationship Department</b> <b>BSE Limited</b> 1 <sup>st</sup> Floor, P. Jeejeebhoy Towers, Dalal Street, Mumbai – 400 001 Stock Code: 500186
---	---

Dear Sirs,

**Sub: Disclosure under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") - Newspaper Advertisement**

Pursuant to Regulation 30 read with Schedule III Part A Para A of SEBI Listing Regulations, we enclose the copies of newspaper advertisement published in Business Line (English), Business Standard (English) and Loksatta (Gujarati), in compliance with Ministry of Corporate Affairs Circular No. 09/2024 dated September 19, 2024, intimating that the 41<sup>st</sup> Annual General Meeting of the Company will be held on Monday, September 15, 2025 at 10:30 a.m. through Video Conferencing / Other Audio Visual Means.

The above information is also available on the website of the Company [www.hoec.com](http://www.hoec.com).

We request you to take the same on record.

Thank you,

Yours Sincerely,

For **Hindustan Oil Exploration Company Limited**

**G Josephin Daisy**

**Company Secretary and Compliance Officer**

Encl.: a/a



QUICKLY.

Srinivasan K Swamy  
elected AAAI President



**Chennai:** Srinivasan K Swamy, Executive Group Chairman of RK Swamy Ltd, has been elected as the President of the Advertising Agencies Association of India (AAAI) for the year 2025-26 at its annual general body meeting. He will be replacing outgoing President Prasanth Kumar, who will take charge as the Ex-Officio member of the AAAI Board. **OUR BUREAU**

Gaurav Bhalotia  
named EY India CTO

**Bengaluru:** EY India has appointed Gaurav Bhalotia as its new Chief Technology Officer (CTO) to lead its innovation and technology strategy, working closely with the client service and product teams to enhance and expand the firm's software-driven solutions. **OUR BUREAU**

Swiggy partners with  
Bounce for e-scooters

**Mumbai:** Food delivery major Swiggy has partnered with electric mobility firm Bounce for the deployment of the latter's e-scooters in its delivery fleet in various cities in a phased manner. In the first phase, Bounce will deploy e-scooters across Delhi-NCR and Bengaluru over the next three months, Swiggy said. These vehicles will be available on the Bounce' mobile app as well as Swiggy's delivery partner app at special pricing exclusively for Swiggy and Instamart delivery partners, it said. **PTI**

# Why India remains a key piece in the global textile value chain

**WEAVING SUCCESS.** The country contributes 12-13% of global textile export earnings, ranking 3<sup>rd</sup> worldwide

**Aishwarya Kumar**  
Bengaluru

India is an important puzzle in the global textile scenario, going beyond tariffs in shaping sourcing decisions. Despite the US imposing a steep 50 per cent duty on Indian exports, textile players argue that India's role in the global value chain extends far beyond tariff math.

A Vijay Anand, CEO of Knit Gallery, pointed out that India's raw material base gives it a distinct edge. "India is the second-largest producer of cotton after China, which provides a major advantage compared to competitors like Bangladesh, Vietnam or Sri Lanka," he said.

## RAW MATERIAL EDGE

This raw material depth feeds into India's global position. The country contributes about 12-13 per cent of global textile export earnings, ranking third world-

wide. "India holds nearly 11 per cent market share, shipping \$6.5 billion annually. While the US leads in volumes and Australia in premium long-staple cotton, India's strength lies in its cultivation base, competitive pricing and ability to supply a wide range of cotton types to markets such as Bangladesh, Vietnam and China," explained Sanjay Jain, Group CEO, PDS Ltd.

Khiroda Jena, CFO, Bombay Dyeing, said that for many premium and value-conscious buyers, these strengths outweigh just tariff benefits. For categories like premium cotton home textiles, India's capabilities are not easily substitutable.

Tariffs may impact price-sensitive segments, but long-term sourcing relationships and India's strengths in sustainable, traceable production will keep it a preferred destination, he added.

On the trade policy front, Ankit Jaipuria, Co-founder of ZYOD, clarified that tariff



**DISTINCT EDGE.** If cotton is India's foundation, integration is its moat. Few countries combine raw material, spinning, weaving, processing and garmenting at the scale India does

advantages for rivals are often overstated. "The US does not have free-trade agreements with Bangladesh or Vietnam. Vietnam only has a Trade and Investment Framework Agreement, which is a dialogue platform, not an FTA."

Jain acknowledged that tariff differentials over Bangladesh and Vietnam will influence buying patterns. Bangladesh and Vietnam could benefit from significantly lower tariff rates —

around 20 per cent; however, these shifts are expected to be gradual.

## INTEGRATION AS MOAT

If cotton is India's foundation, integration is its moat. Few countries combine raw material, spinning, weaving, processing and garmenting at the scale India does.

"India offers buyers cost efficiency, flexibility in order sizes and the ability to move from raw fibre to fully packaged apparel within the same

ecosystem," Jain pointed out.

Anand added that most are in a bind. "It's very difficult to immediately switch to new suppliers in new countries. Initially, there were talks of overcoming the 25 per cent tariff by sharing costs or using LDP shipment modes but with the full 50 per cent duty, much of the business has come to a standstill," he said.

Shiraz Askari, President of Apollo Fashion International Ltd, noted that the challenges extend beyond textiles. "In leather, much like in textiles, the 50 per cent US tariffs presents a severe short-term challenge, and some contraction in orders is likely as buyers explore alternative sourcing in FTA markets. However, these shifts take time." He added that while FTAs with the UAE and Australia provide limited cushion, the UK agreement, though signed, may take up to nine months for parliamentary approval.

# Eyeing Maharashtra's Vadhvan port, APSEZ begins project study

**Avinash Nair**  
Ahmedabad

Keen to be a party in the construction of the ₹76,200 crore Vadhvan port in Maharashtra, Adani Port and Special Economic Zone (APSEZ) said it has started studying the greenfield project being executed near Palghar.

## NEXT LEVEL

"Vadhvan is a great project. We already started studying, and we are in the project study stage. I do believe that this will be the next level of



the port in India, and I think we all have to make it successful."

"The way this port is being

planned, the way it will be executed, it may take some years, and I think, it's worth working on this project," said Ashwani Gupta, Wholesale Director & CEO, APSEZ, adding that the company was keen to grab any opportunity that presents along the 11,000-km-long coastline in India.

## TOTAL CAPACITY

The greenfield container port project will have a total capacity of 24.5 million TEUs and equity contribution from the Jawaharlal Nehru Port Authority

(JNPA) and the Maharashtra Maritime Board (MMB).

Phase-1 of the project is expected to handle about 6.85 million TEUs by 2030. This capacity is expected to rise to 23.2 million TEUs in the second phase.

A special purpose vehicle, Vadhvan Port Project Ltd, has been formed for implementing the project.

"By 2047, India wants to have 10 billion tonne capacity. Now, the 10 billion tonnes can only come by making these kinds of big, giant greenfield projects, and Vadhvan is one of them. If

India wants to do 10 billion tonnes, obviously, with a 33 per cent market share target by 2047, we should be having more than 3.5 billion tonnes. So, definitely, we can't have 3.5 billion tonnes if we are not party to this big capacity expansion at India level," Gupta recently told investors during an earnings call.

## CONTAINER CARGO

Eyeing opportunity in container cargo in India, the company will also be going for capacity expansion at its ports in India.

# 'US, Bangladesh, UK top list for tourist arrivals in India'

**Press Trust of India**  
New Delhi

The US, Bangladesh, the UK, Australia and Canada were the top five source countries for foreign tourist arrivals (FTAs) in India in the last five years, according to data shared by the government.

Union Culture Minister Gajendra Singh Shekhawat shared the data in a written response to queries related to FTAs in the Lok Sabha.

The FTA figures stood at 99.52 lakh for 2024, according to government data.

## POST-COVID SCENE

The Minister was asked details related to FTAs recorded in the country during the last five years and whether India's tourism sector has seen a significant recovery after the Covid-19 pandemic, with international tourist arrivals exceeding pre-pandemic levels.

According to the UN World Tourism Organisa-

tion, international tourist arrivals have two components, namely foreign tourist arrivals (FTAs) and arrivals of non-resident nationals.

The Minister was also asked details about the top 10 source markets for FTAs in India during the last five

years. Shekhawat, in his response, shared tabulated data of top 10 source countries for FTAs during the last five years (2020-2024).

The top 10 countries for FTAs in India during this period were the US, Bangladesh, the UK, Aus-

tralia, Canada, Malaysia, Sri Lanka, Germany, France and Singapore, according to the data.

The year-wise FTAs stood at 27.45 lakh (2020), 15.27 lakh (2021), 64.37 lakh (2022), 95.21 lakh (2023) and 99.52 lakh (2024).

**National Agricultural Co-operative Marketing Federation of India Limited (NAFED)**  
NAFED House, Sidhartha Enclave, Ring Road, Ashram Chowk, New Delhi-110014

**CORRIGENDUM TO TENDER NOTICE (ONION TRANSPORT TENDER)**

Corrigendum to Tender Notice ID No. 954/2025-26 Dated 15-08-2025 for transportation of onion issued by NAFED is uploaded in NAFED website. Interested parties may visit website [www.nafed-india.com/tenders](http://www.nafed-india.com/tenders) for detailed information.

**Horticulture Division**

**TELANGANA STATE POWER GENERATION CORPORATION LIMITED**  
**VIDYUT SOUDHA :: HYDERABAD - 500 082.**

**T.No.e-14/CE/Civil/Thermal/TGGENCO/2025-26**  
KTSPS-V&VI – Raising of additional Ash Pond bunds from Ch:0 m to 3200 M and Suraram bund from Ch:4400 M to Ch:5450 M from EL(+) 115.50 to EL(+) 120.50 M including raising of wells and Spillway at Kothagudem Thermal Power Station Stages V&VI - Paloncha, Bhadradi Kothagudem Dist. Value of the works **Rs.40,09,42,853/-** Scheduled Open & Closing Date: **05.08.2025 at 19:00 Hrs. & 20.08.2025 at 15:00 Hrs.**

**T.No.e-302/GETPC/SE/JEME-16/GHP/BTPS/TGGENCO/2025-26**  
BTPS – New conveying system for diversion of raw coal from the existing crusher house to stock the raw coal near chain conveyors area and construction of space frame structure raw coal storage shed at Bhadradi Thermal Power Station, Manuguru, Bhadradi Kothagudem Dist. Value of the works **Rs.1,09,43,000/-** Scheduled Extended up to: **28.08.2025 at 16:00 Hrs.**

**T.No.e-03/CE/HPC&HP/SE/PI/TGGENCO/2025-26**  
NSHES – Procurement and installation of a new microprocessor-based electronic governor in place of the existing ASE make turbine governor in place of the existing ASE make turbine governor and runner blade controller (HPC600) including its Design, Manufacture, Supply, Inspection & testing at manufacturer works before dispatch, Delivery along with mandatory spares, Erection Cabling, Termination Testing & Commissioning and its integration with the existing Mechanical Electro- Hydraulic Control Unit(E40M) duly dis-assembling of existing complete EHGC Governor Control panel (i.e. Electronic panel only) in the control room, along with its old cables for Unit-2 at Nagarjunasagar Power House, Nellore dist. Value of the works **Rs.85,000/-** Scheduled Extended up to: **28.08.2025 at 16:00 Hrs.**

**T.No.e-202/CE/O&M/KTSPS-V&VI/C&M/WP22/DE/RP/TGGENCO/2025-26**  
KTSPS-V&VI – Procurement of Spares suitable for Flowmore make CW pump model:1850A/VT in water system KTSPS VI Stage at Kothagudem Thermal Power Station Stage-VI Paloncha, Bhadradi Kothagudem Dist. Value of the works **Rs.33,89,488/-** Scheduled Open & Closing Date: **28.08.2025 at 19:00 Hrs. & 18.09.2025 at 15:30 Hrs.**

**T.No.e-16/CE/O&M/KTSPS-VII/P12/EM/TGGENCO/2025-26**  
KTSPS-VII – Enquiry for Supply of 420 KV Capacitor Transformer metering and protection at Kothagudem Thermal Power Station Stage-VI, Paloncha, Bhadradi Kothagudem Dist. Value of the works: **Rs.33,40,000/-** Scheduled Open & Closing Date: **07.08.2025 at 19:30 Hrs & 26.08.2025 at 15:30 Hrs.**

**T.No.e-139/CE/O&M/KTSPS-VII/P32/C&M&TM/TGGENCO/2025-26**  
KTSPS-VII – Procurement of ROTO-Z oil at Kothagudem Thermal Power Station Stage-VII, Paloncha, Bhadradi Kothagudem Dist. Value of the works: **Rs.17,07,868/-** Scheduled Open & Closing Date: **17.07.2025 at 17:35 Hrs & 22.08.2025 at 15:30 Hrs.**

**T.No.e-01/CE/Constn/SE/ADM/BTPS/TGGENCO/2025-26**  
BTPS-Installation of electrical equipment and fixtures to various structures of gate complex in project at Bhadradi Thermal Power Station, Manuguru, Bhadradi Kothagudem Dist. Value of the works **Rs.19,08,126/-** Scheduled Open & Closing Date: **07.08.2025 at 19:00 Hrs & 06.09.2025 at 16:00 Hrs.**

For further Details: "[www.tggenco.co.in](http://www.tggenco.co.in) & <https://tender.telangana.gov.in>"  
DIPR R.O. No.: 502-PPCL-AGENCY/ADVT/1/2025-26

**Koregaon Nagar Panchayat, Koregaon**  
(Tel. No. 02163-220280)

**Public E-Tender Notice for 2024-25**

**Ot. No. 1246/2025 Date :- 18/08/2025**

Through this public tender notice, the contractors are informed that the construction department of Koregaon Nagar Panchayat is publishing the public e-tender for the below works. The terms and conditions of the said e-tender can be downloaded from the website <http://mahatenders.gov.in>. Interested tender holders should note this.

1. Construction of a wall compound, room for materials and provision of other facilities at the new crematorium behind the market yard in Koregaon city.
2. Electrical work to be done in the new building of the commercial complex and vegetable market in Azad Chowk, Koregaon.

**Vice President**  
**Chief Officer** **Koregaon Nagar Panchayat** **President**

**HOEC® HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED**  
(CIN: L11100GJ1996PLC029880)

**Registered Office:** HOEC House, Tandella Road, Vadodara – 390 020, Gujarat, India  
**Chennai Office:** Lakshmi Chambers, 192, St. Mary's Road, Alwarpet, Chennai – 600 018, Tamil Nadu, India. : **Phone:** 044-66229000, Fax: 044-66229011/12  
**E-mail:** hoecsharea@hoec.com, **Website:** www.hoec.com

**41<sup>ST</sup> ANNUAL GENERAL MEETING OF THE COMPANY**

Members are requested to note that the **41<sup>st</sup> Annual General Meeting (AGM) of the Company will be held on Monday, the 15<sup>th</sup> day of September 2025 at 10.30 a.m.** through Video Conferencing (VC) / Other Audio-Visual Means (OAVM), in compliance with circulars issued by the Ministry of Corporate Affairs (MCA) and the Securities and Exchange Board of India (SEBI) the latest being General Circular 09/2024 dated September 19, 2024 issued by MCA and SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated October 3, 2024 issued by SEBI (hereinafter collectively referred to as “the Circulars”) and all other applicable laws, to transact the businesses that will be set forth in the Notice of the 41<sup>st</sup> AGM.

In compliance with the above Circulars, the Notice of the AGM along with the Annual Report of FY 2024-25 will be sent only through electronic mode to those Members whose e-mail IDs are registered with the Company / Depository Participants.

A letter providing the web-link and exact path where complete details of Annual Report of FY 2024-25 is available will be sent to Members who have not registered their e-mail IDs.

Members may note that the Notice and Annual Report of FY 2024-25 will also be made available on the Company's website [www.hoec.com](http://www.hoec.com), websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) respectively, and on the website of CDSL [www.evotingindia.com](http://www.evotingindia.com).

Members who have not registered their e-mail addresses so far are requested to register the same in respect of shares held in dematerialized form with the Depository through their Depository Participants (DP) and in respect of shares held in physical form by writing to the Registrar & Share Transfer Agent (RTA) - MUF& Intime India Private Limited (formerly known as Link Intime India Private Limited), “Geetakunj”, 1, Bhakti Nagar Society, Behind ABS Tower, Old Padra Road, Vadodara, Gujarat 390015; Email id: [vadodara@in.mpmc.mufg.com](mailto:vadodara@in.mpmc.mufg.com) or by submitting the KYC forms at <https://web.in.mpmc.mufg.com/KYC-downloads.html>.

The Company will provide the facility to its Members to exercise their right to vote by electronic means, both through remote e-voting and e-voting at the AGM. The detailed instructions on the process of e-voting will be provided as part of the Notice of the 41<sup>st</sup> AGM.

By order of the Board of Directors  
For **HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED**  
Sd/-  
**G. Josephin Daisy**  
Company Secretary

**Place :** Chennai  
**Date :** August 18, 2025

**Enterprise Connect** Business Initiative

**SBI Hosts Mega Jan Suraksha Financial Inclusion Saturation & Awareness Camp at Khalapur**

• Distributed Sanction letters to MUDRA Loan beneficiaries and SHG's in the region.  
• Extended claim amount to beneficiaries under PMSBY and PMJJBY  
• Distributed bicycles to girl students of Chiltan High School, and renovation and painting support to the Marathi Primary School, Khopoli

**Raigad/Mumbai, 14 August 2025:** State Bank of India (SBI) organized a Mega Jan Suraksha Saturation and Awareness Camp at Khalapur with an aim to achieve 100% coverage of financial inclusion schemes at Gram Panchayat and urban local body levels across the district. The initiative is aligned with three month nationwide Financial Inclusion (FI) campaign launched by the Department of Financial Services.

Shri. C. S. Setty, Chairman, SBI was chief guest at the event. Shri Arvind Kumar Singh, DMD, SBI, Mrs. Manju Sharma, Chief General Manager, SBI Mumbai Metro Circle and other Circle functionaries, were also present at the event.

At the camp, SBI had arranged dedicated facilities for Re-KYC services and account reactivation, enabling customers, especially from gram panchayats in Khalapur and adjoining Lonavala talukas, to update their records and become eligible to receive Direct Benefit Transfer (DBT) payments under various Government of India schemes.

On the occasion, **Shri. C. S. Setty, Chairman, SBI**, requested our customers for the timely Re-KYC and reactivation of dormant accounts to ensure that they can have seamless access to banking services including government welfare benefits. The bank is also committed to empower customers with financial literacy and digital safety.

The camp also featured short awareness sessions on grievance redressal mechanisms and precautions against digital fraud, equipping attendees with knowledge on staying secure in the digital payments ecosystem.

**As part of the day's proceedings:**

- Sanction letters were distributed for MUDRA Loans and to multiple Self-Help Groups from the region.
- Settlement amounts under Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) and Pradhan Mantri Jivan Jyoti Bima Yojana (PMJJBY) were handed over to beneficiaries.
- Under SBI's CSR initiatives, bicycles were distributed to meritorious girl students of Chiltan High School, and renovation and painting support was extended to the Marathi Primary School, Shanti Nagar, Khopoli.

The event witnessed enthusiastic participation, with many customers completing their Re-KYC updation on-site. Participants, local leaders, and community members expressed appreciation for SBI's efforts in bringing essential banking services and awareness to the doorstep of rural and semi-urban communities.

**Intas Pharmaceuticals Launches HETRONIFY™ (Serplulimab) for Advanced Small Cell Lung Cancer**

Intas Pharmaceuticals has launched Hetrionify™ (Serplulimab), the first PD-1 inhibitor globally approved for the treatment of Extensive-Stage Small Cell Lung Cancer (ES-SCLC), in the Indian market. This launch a strategic licensing agreement between Intas Pharmaceuticals Limited and Shanghai Henlius Biotech, Inc., further strengthens Intas' oncology portfolio and reinforcing its commitment to delivering cutting-edge therapies to patients in India. The product is currently present in over 40 countries and marks another major milestone, following the successful Launch in Europe.

**79th Independence Day Celebrations At LIC Southern Zonal Office**

LIC of India, Southern Zone, celebrated the 79th Independence Day at LIC Building, Anna Salai, Chennai. Shri. K.Murlidar, Zonal Manager of Southern Zone hoisted the National Tri-Colour Flag and addressed the gathering. Extending his Warm Independence Day greetings on the occasion, Zonal Manager recalled the outstanding contribution

made by LIC for the growth and prosperity of our Country. LIC has been consistently striving to work towards the promises given to its Policyholders. For the year ending 31/03/25, Corporation had settled 225.18 lakh claims to the tune of Rs. 2.61 lakh crore. During the year 2024-25 LIC has offered Insurance Coverage through 1.77 crores policies and South Zone sold over 15.06 lacs policies during the same period. LIC's Life Fund as at 31/03/25 is 47.84 lakh crores and Asset under Management is 54.52 lakh crores and LIC commands a Market Cap of 5.80 lakh crores as on date.

Transformation has been LIC's forte and the DIVE (Digital Innovation and Value Enhancement) project, is a comprehensive Digital Transformation Initiative aimed at improving customers' experience and LIC's digital infrastructure. LIC's Customer Centric initiatives include Whatsapp services and (LIC Mitra) CHATBOT facilities which is available in LIC Portal. LIC Digital App is also available for quick transactions on Mobile handsets.

On 9th December 2025, Hon'ble Prime Minister Shri Narendra Modi launched BimaSakhiYojana, aimed at Women Empowerment through financial inclusion and Insurance awareness. This Scheme aims at training women to become Insurance Agents with an added stipend in addition to Commission. As on date, 2.23 lac women have been enrolled as BimaSakhis all over India. As far as LIC Southern Zone is concerned, as on date, 19047 Women have joined BimaSakhi Scheme. Kerala State has achieved the unique distinction of enrolling BimaSakhis in all Village Panchayats which is totaling to 941 village panchayats.

Claim settlement has been our strong domain and Southern Zone tops the Country in all the Claim Settlement Ratios. For the year 2024-25, Southern Zone settled Maturity and Death Claims to the tune of Rs.22,265 crores to 23.86 lac claimants. In the Current Fiscal, South Zone has settled Total Claims amounting to the tune of Rs.5,876 crores to 5.59 lac claimants.

LIC of India created a Guinness Book of World Records for the “Most Life Insurance Policies Sold in 24 Hours” by selling an impressive 5.88 lac policies on a single day across India on 20th January 2025. LIC was also awarded the ISO Certificate from British Standards Institute on 29/05/2025 & also stands as a strong Insurance Brand till date.

As part of CSR activity LIC Golden Jubilee Foundation(GJF) caters to the needy and weaker section of the society to reduce poverty, helps in advancement of Education, Health Care and donates objects of general public utility. Southern Zonal Office has sanctioned 25.53 Crores under 102 Projects as on date. GJF also provides scholarships to the Students of economically weaker sections of the Society. An amount of 11.40 crores were distributed in the 2024-25 to 3,033 Scholars.

As a Market Leader, LIC has always kept the needs and aspiration of the Insurance Public and it remains committed to its mission by providing comprehensive financial security to every household in India and will continue to be the Strongest Insurance Brand. On the occasion of Independence Day, the Zonal Manager encouraged LICians to renew their commitment to delivering the highest quality service to all customers.

**Bihar's SVEP Programme Changing the Rural Landscape - "Pushpa Devi Leads the Way"**

The special SVEP (Start-Up Village Entrepreneurship Programme), aimed towards developing rural areas, transformed Pushpa Devi's life. From a homemaker in Gaya's Sobh Bazaar to a successful entrepreneur, 38-year-old Pushpa Devi's journey under SVEP demonstrates the power of rural enterprise, as she turned her art and craft skills into business selling decorative items and tailoring garments. She joined Soni Jeevika Mahila Self-Help Group, where she comes to know about SVEP Programme, under this programme, she completed entrepreneurship Development training Programme. Further she availed 50,000 rupees loan in December 2018. Now she started production of different decorative item from her home. Today she earns 12,000–13,000 rupees monthly. She is also providing training to 40–50 young women on stitching and art craft. She is guiding and inspiring these women for self-reliance.

In 2017, SVEP was launched in Bihar, SVEP rapidly evolved as a significant resource for rural entrepreneurship and covers 32 blocks in the state, creating a vital resource in the development of self-employment in the state. SVEP has proven to be a key driver and provider of financial assistance. So far, more than 27087 business enterprise plans have been prepared and 25189 of them, loan has been funded amounting to 17 crores rupees. The programme has successfully promoted 258 Scheduled Tribe enterprises to self-employment as well.

# EV makers counter magnet shortage by sourcing locally

**S Ronendra Singh**  
New Delhi

Electric vehicle (EV) manufacturers are sourcing locally available resized magnets and managing supplies from countries like South Korea after China imposed export restrictions; this is to prevent an interruption to production ahead of the festival period.

KN Radhakrishnan, Director and Chief Executive Officer, TVS Motor Company, said at a post-earnings call: "Short term, we are managing with the stocks what we have. We also resized some higher sized magnets, which are locally available. We are also exploring some alternate strategies in the short term... Currently, we are managing the daily production. We are just able to manage like that."

Similarly, Ather Energy noted that retail sales could take a hit due to low stocks but the company was planning to mitigate this through channel inventory management and alternative sourcing strategy.

At its post earnings call, Tarun Mehta, Executive Director and CEO, Ather Energy, said the company was exploring several mitigation options, which includes partially assembling motors in China to avoid direct magnet imports, transitioning to heavy rare-earth-free magnets, and shifting entirely to ferrite-based motor technologies, which eliminate rare earth usage.

## 'A CHALLENGE'

"As far as the rare earth metal is concerned, it is an industry-wide phenomenon. It is a challenge, no doubt about that... We are covered for the Q2 FY26 for both ICE and EV, and we continue to work on alternatives; we will



EV makers have not informed the government about the volume of stocks of rare earth magnets currently with them

try and see that we circumvent the problem, said Vikram Kasbekar, Acting CEO at Hero MotoCorp.

## STOCKS AVAILABLE

EV makers have not yet informed the government about the stock volume of rare earth magnets available with them.

The Ministry of Heavy Industries (MHI) had sent directives last month, asking OEMs to declare rare earth magnet inventory, so that the real crisis could be measured.

However, no OEM has sent a response to the MHI till date.

## HALTED SUBSIDIES

This is the reason why the Ministry halted subsidies last month to OEMs for both the production linked incentive (PLI) scheme and the Prime Minister Electric Drive Revolution in Innovative Vehicle Enhancement (PM E-DRIVE).

"They have not shared their sources with us yet," a senior official at MHI told *businessline*.

Sources from the MHI also said that a call is yet to be taken on resuming the subsidies under both schemes until the level of scarcity of rare earth magnets is known.







**Indian Overseas Bank**  
Good people to grow with

**COMMERCIAL PREMISES 1200 TO 1500 Sq.Ft. ON RENT FOR**  
(1) DWARKA (2) KHAMBHALIYA (3) MOTIKHAVDI - JAMNAGAR (4) SONMATH  
(5) ADIPUR - KUTCH (6) SHAPAR - RAJKOT (7) UNIVERSITY ROAD - RAJKOT  
(8) KOTHARIYA - RAJKOT (9) RANCHHOD NAGAR - RAJKOT (10) JIVRAJ PARK - RAJKOT  
(11) JAGATPUR - AHMEDABAD (12) ODHAV - AHMEDABAD (13) HIMMATNAGAR

Interested actual owners with all the required eligibility as per tender may apply with full details as per format available on our Bank's website ([www.job.in](http://www.job.in)) to CRM, Indian Overseas Bank, Regional Office, 1st Floor, Sharad Shopping Centre, Chinubhai Tower, Ashram Road, Ahmedabad - 380 009, within 15 days. Bank reserves the right to reject any/all offers without assigning any reason whatsoever. Bank will not pay any kind of brokerage in this connection.



**Indian Overseas Bank - Sachin Branch**  
Ground Floor, Shree Darshan Complex, Opp. LD High School, Station Road, Sachin-394230. Ph.: 261-2390110, Email: [job2392@job.in](mailto:job2392@job.in)

**(APPENDIX IV) POSSESSION NOTICE (For immovable Property) (Rule 8 (1))**


The undersigned being the Authorized Officer of the **Indian Overseas Bank** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 02.05.2025, Paper publication on 24.05.2025, calling upon the borrowers **(1) Mr. Deshidipak Shrichandra Yadav S/o Mr. Shrichandra Yadav**, R/o Row House Plot No.79, Shri Ganesh Residency, Near Rashi Township, Kadodara, Bardoli, Road, Moje:-Kareli, Sub-District:-Palsana, District:-Surat, Gujarat, PIN-389001 and **(2) Mrs. Kushma Devi W/o Mr. Shrichandra Yadav** (Co borrower /mortgagor) Row House Plot No.79, Shri Ganesh Residency, Near Rashi Township, Kadodara, Bardoli, Road, Moje:-Kareli, Sub District:-Palsana, District:-Surat, Gujarat, PIN-389001 Property Address:- Row House Plot No.79, Shri Ganesh Residency, Near Rashi Township, Kadodara, Bardoli, Road, Moje:-Kareli, Sub District:-Palsana, District:-Surat, Gujarat, PIN-389001 (hereinafter referred to as "borrowers") to repay the amount mentioned in the notice being **Rs 12,85,934/- as on 01.05.2025** with further interest at contractual rates and rests, charges etc till date of realization within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this **14th day of Aug 2025** the year.

(2) The borrowers in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **Indian Overseas Bank** for an amount of **Rs 13,15,323.85** (as on 13.08.2025) with interest thereon at contractual rates & rests as agreed, charges etc, from the aforesaid date mentioned in the demand notice till date of payment less repayments, if any, made after issuance of Demand Notice. The dues payable as on the date of taking possession is **Rs 13,15,323.85 (as on 13.08.2025)** Payable with further interest at contractual rates & rests, charges etc., till date of payment.

(3) The borrowers' attention is invited to provisions of Sub-section (8) of the Section 13 of the Act, in respect of time available to them, to redeem the secured assets.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY		
Row House Plot No.79, Shri Ganesh Residency, Near Rashi Township, Kadodara, Bardoli Road, Moje:-Kareli, Sub District:-Palsana, District:-Surat, Gujarat, PIN-389001, in the name of SI No. 1 & 2. Bounded: North:-Adj. Plot No.80, South:- Adj. Plot No.79-A, East:-Adj. Plot No.94, West:- Society Internal Road.		
Date: 19.08.2025 - Place: Surat	Authorised Officer - Indian Overseas Bank	



**ADVANCE SYNTAX LIMITED**  
CIN : L17119G1990PLC014406  
Regd. Office: 233/2 & 238/2, POR G.I.D.C RAMANGAMD, VADODARA, GJ- 391243  
Tel No. : +91-8980025937, E-mail: [midas1002003@hotmail.com](mailto:midas1002003@hotmail.com), Website: [www.midasglitter.com](http://www.midasglitter.com)

**EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULT FOR THE QUARTER ENDED JUNE 30, 2025**  
(Amount in INR lakhs)

Sr. No.	Particulars	Quarter Ended 30.06.2025 (Unaudited)	Previous Year Ended 31.03.2023 (Unaudited)	Quarter Ended 31.03.2024 (Audited)
1	Total income from operations (net)	-	-	-
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-	(13.88)	(3.71)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-	(52.30)	(1754.72)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-	(52.30)	(1752.45)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-	(52.30)	(1752.45)
6	Paid up Equity Share Capital	1109.71	1109.71	1109.71
7	Earnings per share (Face Value of Rs. 10 each) Basic & Diluted	-	(0.47)	-15.79

**NOTE:**  
1) The above Standalone Financial Results were reviewed by the audit committee and thereafter were approved and taken on record by the board of directors in their meeting held on 14th August 2025.  
2) The company has single primary business segment and there is no separate reportable segment in terms of INDAS.  
3) Previous quarter/year figure have been regrouped /reclassified, wherever found necessary, to confirm to current quarter/year classification.  
4) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) namely [www.bseindia.com](http://www.bseindia.com) and on the company's website [www.midasglitter.com](http://www.midasglitter.com).  
**By Order of the Board,**  
**Sd/-**  
**BhavanVora**  
**(Managing Director)**

**Place: Vadodara**  
**Date: 14th August, 2025.**



**HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED**  
(CIN: L11100GJ1996PLC029880)  
Registered Office: "HOEC House", Tandalia Road, Vadodara - 390 020, Gujarat, India  
Chennai Office: "Lakshmi Chambers", 192, St. Mary's Road, Alwarpet, Chennai - 600 018, Tamil Nadu, India. Phone: 044-66229000, Fax: 044-66229011/12  
E-mail: [hoecshare@hoec.com](mailto:hoecshare@hoec.com), Website: [www.hoec.com](http://www.hoec.com)

**41<sup>ST</sup> ANNUAL GENERAL MEETING OF THE COMPANY**  
Members are requested to note that the **41<sup>st</sup> Annual General Meeting (AGM)** of the Company will be held on **Monday, the 15<sup>th</sup> day of September 2025 at 10.30 a.m.** through Video Conferencing (VC) / Other Audio-Visual Means (OAVM), in compliance with circulars issued by the Ministry of Corporate Affairs (MCA) and the Securities and Exchange Board of India (SEBI) the latest being General Circular 09/2024 dated September 19, 2024 issued by MCA and SEBI/HO/CFD/CFD-PoD-2/P/CI/R/2024/133 dated October 3, 2024 issued by SEBI (hereinafter collectively referred to as "the Circulars") and all other applicable laws, to transact the businesses that will be set forth in the Notice of the 41<sup>st</sup> AGM.  
In compliance with the above Circulars, the Notice of the AGM along with the Annual Report of FY 2024-25 will be sent only through electronic mode to those Members whose e-mail IDs are registered with the Company / Depository Participants.  
A letter providing the web-link and exact path where complete details of Annual Report of FY 2024-25 is available will be sent to Members who have not registered their e-mail IDs.  
Members may note that the Notice and Annual Report of FY 2024-25 will also be made available on the Company's website [www.hoec.com](http://www.hoec.com), websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) respectively, and on the website of CDSL [www.evotingindia.com](http://www.evotingindia.com).  
Members who have not registered their e-mail addresses so far are requested to register the same in respect of shares held in dematerialized form with the Depository through their Depository Participants (DP) and in respect of shares held in physical form by writing to the Registrar & Share Transfer Agent (RTA) - MUGF Intime India Private Limited (formerly known as Link Intime India Private Limited), "Geetaktunj", 1, Bhakti Nagar Society, Behind ABS Tower, Old Padra Road, Vadodara, Gujarat 390015; Email id: [vadodara@in.mpmis.mugf.com](mailto:vadodara@in.mpmis.mugf.com) or by submitting the KYC forms at <https://web.in.mpmis.mugf.com/KYC-downloads.html>.  
The Company will provide the facility to its Members to exercise their right to vote by electronic means, both through remote e-voting and e-voting at the AGM. The detailed instructions on the process of e-voting will be provided as part of the Notice of the 41<sup>st</sup> AGM.  
**By order of the Board of Directors**  
**For HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED**  
**Sd/-**  
**Place : Chennai**  
**Date : August 18, 2025**  
**G. Josephin Daisy**  
**Company Secretary**



**सेंट बैंक होम फायनेन्स लिमिटेड**  
**Cent Bank Home Finance Limited**

**APPENDIX- IV-A [SEE PROVISIO TO RULE 8 (6)]**  
**TENDER CUM AUCTION SALE NOTICE**  
**SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES**

**सेंट्रल बैंक ऑफ होमिन्स का अनुषंगी**      **Subsidiary of Central Bank of India**

**Auction sale notice for sale of immovable assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.**  
Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged / charged to the secured creditor, the **Physical Possession** of which has been taken by the **Authorized Officer of Cent Bank Home Finance Ltd.** Secured Creditor, will be sold on **"As is where is", "As is what is" and "Whatever there is"** Basis on Date Mention Below for recovery of amount mentioned against property due to the Secured Creditor from the Borrower. The Reserve Price and Earnest Money Deposit, description of the property are as mentioned in the table below:

S. No.	Name of the Borrower/ Co-Borrower & LAN No.	Details Of The Property	Amount Outstanding as on date of demand notice (₹)	Date of Demand Notice		Reserve Price (₹)
				Possession Auction Date	Earnest Money Deposit (₹) 10%	
1	Mr. Hareesh Vaidenkar & Mrs. Nirmaladevi Vaidenkar LAN:- HL-01603010000119	House No. F-18, Aryabhata Co-Op Society, Nr. Priyadarshini Nagar, Susen Char Rasta, Makarpura 390010 Property Area:- 65.98 Sq.mt. Boundaries: East: By Priyadarshini Society, West: By Makarpura Road, North: By Flat No-F-19, South : By Flat No-F-17	<b>11,30,332/-</b> + Interest and other charges	<b>19.04.2024</b> <b>28.09.2024</b> <b>(Physical)</b> <b>04.09.2025</b>		<b>12,60,000/-</b> <b>1,26,000/-</b>
2	Mr.Mohan Rajendran Naidu/ Mr. Jaydeepsinh Parsinghkhali Rathava (Guarantor) LAN:-HL-01603010000139	Flat No. C-504, 5th Floor, 5th Avenue, Near Alva Naka, Saraswati Gidc Road, Manjalpur, Vadodara, 390 011 Property Area:- 738 Sq.ft. Boundaries: East: By Staircase, Passage Then Flat No. C-501, West: By Internal Road Then Tower D-3, North: By Club House, South : By Flat No. C-503	<b>32,48,285/-</b> + Interest and other charges	<b>19.04.2024</b> <b>20.09.2024</b> <b>(Physical)</b> <b>04.09.2025</b>		<b>33,50,000/-</b> <b>3,35,000/-</b>
3	Mr. Pushpendra Prakeshrao Shinde & Mrs. Minaxi Pushpendra Shinde LAN:-HL-01603010000093	Flat No. 904, 9th Floor, Tower-Sneh,Shreem Galaxy, B/H Bright Day School, Nr. Shamam Residency, Bhalay, Vadodara 391410 Property Area:- 99.03 Sq.mtrs Super Built Up Area Boundaries: East: Shri 301, West: Road, Tennis Court Area, North: Swimming Pool After Road, South : Sneh Flat No-903	<b>33,97,918/-</b> + Interest and other charges	<b>04.02.2023</b> <b>29.04.2023</b> <b>(Physical)</b> <b>04.09.2025</b>		<b>23,00,000/-</b> <b>2,30,000/-</b>
4	Mrs. Arpita Hiteshbhai Jariya & Mr. Hitesh Jagdishbhai Jaria (Guarantor) LAN:-HL-01603010000027	Tower- C, S.F. Flat No. C-204, Satyam Residency, Tajpura Road, Opp. Sitaram Park, Padra, Vadodara-391440, Property Area:- 65.25 Sq.mtr Boundaries: East: By After Open Space, Flat No. B-203, West: By Flat No. C-203, North: By After Passage, Flat No. C-302, South : By Open Space -Shree Ram Residency	<b>16,16,073/-</b> + Interest and other charges	<b>12.04.2022</b> <b>08.02.2025</b> <b>(Physical)</b> <b>04.09.2025</b>		<b>18,36,000/-</b> <b>1,83,600/-</b>
5	Mr. Maheshbhai Sanabhai Tadi & Mrs. Kailashbhai Maheshbhai Tadi (Guarantor) LAN:-HL-01603010000041 & Top-Up-01603020000062	D-503 Pushpam 241 Residency, N/R Dwarka Nagri, B/H Reliance Fresh Lane, Waghodina Ring Road, Vadodara-390019 Property Area:-41.32 Sq. Mtr Boundaries: East: By Tower C, West: By Flat D-504, North: By Flat D-502, South : By Tower's Margin	<b>10,69,640/-</b> + Interest and other charges	<b>22.07.2024</b> <b>06.02.2025</b> <b>(Physical)</b> <b>04.09.2025</b>		<b>16,10,000/-</b> <b>1,61,000/-</b>
6	Mr. Gopalbhai Sanabhai Mali & Mrs. Gangitaben Gopalbhai Mali (Guarantor) LAN:- HL-01603010000193	Revenue Survey No.240, City Survey No.691 Tower-D Flat No-302, NIKANTR Residency Near Air Force Station Makarpura Vadodara-390014 Property Area:- 41.35 Sq.mtrs Boundaries: East: O.T.S, West: Common Lift, North: Flat No.1/301, South : Margin	<b>15,19,578/-</b> + Interest and other charges	<b>28.10.2024</b> <b>05.04.2025</b> <b>(Physical)</b> <b>20.09.2025</b>		<b>17,36,000/-</b> <b>1,73,600/-</b>

**Terms and conditions:** (1) The Auction is being held on **AS IS WHERE IS", "AS IS WHAT IS"** and **"WHATEVER THERE IS BASIS"** (2) The secured asset will not be sold below the Reserve Price. (3) The intending purchaser/bidder should submit their bids in the prescribed tender form in a closed cover separately for each property, with The Earnest Money Deposit (EMD) amount (not below the 10% of Reserve Price) by means of Demand Draft drawn in favor of **Cent Bank Home Finance Ltd payable at Vadodara on or before 04/09/2025 up to 3.00 PM for S No 1 to 5 and on or before 20/09/2025 up to 3.00 PM for S No 6** at above address of Cent Bank Home Finance Ltd, Vadodara Branch (4) The sealed covers will be opened by the Authorized Officer at Vadodara Branch in the presence of eligible/available intending Bidders who have deposited EMD amount through Demand Draft to participate in **Auction sale on 04/09/2025 at 4.00 PM for S No 1 to 5 and on 20/09/2025 at 4.00 PM for S No 6 (5)** To the best of knowledge and information of the Authorized Officer, there is no encumbrance on the property under sale. However, the intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of property put on auction and claims/ rights/ dues/chain/ affecting the property, prior to submitting their bid. The Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of the bank. The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to the bank. The Authorized Officer/ Secured Creditor shall not be responsible in any way for any third party claims/ rights/ dues (6) It shall be the responsibility of the bidders to inspect and satisfy themselves about the asset and specification before submitting the bid. The inspection of property put on auction will be permitted to interested bidders at sites on **25/08/2025 & 26/08/2025 between 11.00 PM to 4.00 PM for S No 1 to 5 and on 05/09/2025 between 11.00 PM to 4.00 PM for S No 6 (7)** The Earnest Money Deposit (EMD) of the successful bidder/highest bidder shall be retained towards part sale consideration and the EMD of unsuccessful bidders shall be refunded. The Earnest Money Deposit shall not bear any interest. The sale shall be confirmed in favor of the purchaser who has offered the highest sale price in his bid or tender to the Authorized Officer and shall be subject to confirmation by the Secured Creditor. The highest bid will be subject to approval of the secured creditor/Authorized Officer (8) The successful bidder shall be allowed to deposit 25% of the sale price, (in case of the sale price, not more than ten working days and the balance amount shall be paid to the bank. The balance amount shall be paid to the Authorized Officer on or before 15th day of confirmation of sale or such extended period [as may be agreed upon in writing between the purchaser and the secured creditor, in terms of Rule 9(4). In case of default of payment within the period mentioned above all the amount deposited till then shall be forfeited including Earnest money and the property shall be resold and the defaulting purchaser shall forfeit all claims/ rights/ dues/chain/ affecting the property for which it may be subsequently sold (9) The purchaser shall bear the applicable stamp duty/ additional stamp duty/transfer charges, fee etc. and also all the statutory/ non statutory dues, taxes, rates, assessment charges, fees etc. owing to anybody (10) The Authorized Officer is not bound to accept the highest offer and the Authorized Officer has the absolute right to accept or reject any or all offer(s) or adjourn/ postpone/cancel the Auction without assigning any reason therefor (11) This is also a notice to the Borrower/Guarantor/Property owner of the aforesaid loan in respect of the sale of the above mentioned secured Asset (under SARFAESI Act 2002) (under Rule 8(6)).

**Place : Vadodara, Date: 18.08.2025**      **Authorized Officer, Cent Bank Home Finance Ltd., Vadodara**  
In case of discrepancy between notices published in English and Gujarati, the contents of the notice published in English shall prevail  
**Branch --FF-122-123, Kanha Capital, Opp. Express Hotel, R.C. Dutt Road, Alkapuri, Vadodara - 390007**  
**Phone No. 7024110019 / 7024155243 | CIN:- U65922MP1991PLC006427**



**HDFC Bank Limited**  
We understand your world

**Branch: HDFC House, Near Mithalkhali Six Roads, Navrangpura Ahmedabad-380009. Tel : 079-66307000**

**DEMAND NOTICE**

**Under Section 13 (2) of the Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act)** read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002.  
Whereas the undersigned being the Authorised Officer of **HDFC Bank Limited** (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) (HDFC) under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement Of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s)listed hereunder, to pay the amounts mentioned in the respective Demand Notice/s, within 60 days from the date of the respective Notice/s, as per details given below. The undersigned have, caused these Notices to be pasted on the premises of the last known respective addresses of the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s). Copies of the said Notices are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s), may, if they so desire, collect the respective copy from the undersigned on any working day during normal office hours.  
In connection with the above, Notice is hereby given, once again, to the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) to pay to **HDFC**, within 60 days from the date of publication of this Notice, the amounts indicated hereinbelow in their respective names, together with further interest as applicable according to the details mentioned in the said Demand Notices from the respective dates mentioned below in column (c) till the date of payment and / or realisation, read with the loan agreement and other documents/writings, if any, executed by the said Borrower(s). As security for due repayment of the loan, the following Secured Asset(s) have been mortgaged to **HDFC** by the said Borrower (s) respectively. Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets/.

Sr. No.	Name of Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s)	Total Outstanding Dues	Date of Demand Notice	Description of Secured Asset(s) /Immovable Property (ies)
(a)	(b)	(c)	(d)	(e)
1	<b>Wife/Son/Daughter/Husband of MR JADAV BHANUBHAI BIJALBHAI [since deceased] And other known and unknown Legal Heir(s), Legal Representative(s), Successors and Assigns of MR JADAV BHANUBHAI BIJALBHAI [since deceased] (Borrower) MRS JADAV GAURIBEN BHANUBHAI (Co-Borrower)</b>	<b>Rs. 1,874/-, Rs. 5,89,220/-, and Rs. 19,595/- dues respectively as on 30-Jun-25*</b>	<b>05-Aug-2025</b>	FLAT-C-608, FLOOR-6, AKSHARDHAM HEIGHTS - BLOCK C, S NO 97, TPS 113, FP 22, NR MADHAV FARM, OPP MAMLATDAR OFFICE, S. P. RING ROAD, VASTRAL, AHMEDABAD-382418
2	<b>MR TIBHE JAGDISH DILEEP (Borrower)</b>	<b>Rs. 21,37,045/- and Rs. 6,937/- dues respectively as on 30-Jun-25*</b>	<b>05-Aug-2025</b>	FLAT-B/301, FLOOR-3, RASHMI PEARL BLK B, PLOT F. P. 56/1, S NO 574, TP. 58, RASHMI PEARL, OPP. SHRI HARI RESIDENCY, NR. KARNAVATI-2, NAROL- ASLALI HIGHWAY, NAROL, AHMEDABAD-382427
3	<b>MR PARMAR MAHAMADMUNAF AALAMBHAI (Borrower) MRS PARMAR FEMIDABIBI MAHAMADMUNAF (Co-Borrower)</b>	<b>Rs. 17,42,931/- and Rs. 7,55,377/- respectively dues as on 30-Jun-25*</b>	<b>05-Aug-2025</b>	UNIT-D/01, JANNAT CITY DUPLY S NO 203, NR AMIN PARK SOCIETY KASBO, KADI, AHMEDABAD-382715
4	<b>MR MEHTA ANISH RAJNIKANT (Borrower) MRS PATEL JAYASHRI (Co-Borrower)</b>	<b>Rs. 24,15,193/- dues as on 30-Jun-25*</b>	<b>05-Aug-2025</b>	FLAT-G-712, FLOOR-7, OMSHANTI GOLD PLUS-2 BLK G, PLOT FF 7+8, S NO 55+56/1+56/2, TP. 128(VATVA-ASLALI), NR. OMSHANTI BUNGLOWS, GAMDI ROAD, VATVA, AHMEDABAD-382440
5	<b>Wife/Son/Daughter/ Husband of MR MISTRI KUNJAN KANUBHAI [since deceased] And other known and unknown Legal Heir(s), Legal Representative(s), Successors and Assigns of MR MISTRI KUNJAN KANUBHAI [since deceased] (Borrower) MRS MISTRY BHAVIBAHEN KUNJANKUMAR (Co-Borrower)</b>	<b>Rs. 32,95,160/- as on 30-Jun-25*</b>	<b>05-Aug-2025</b>	FLAT-H-1001, FLOOR-10, ADARSH TULIP SKYVIEW BLK H, PLOT FF 5/1, S NO 440, 441, 442, 465, TP. 58, OPP. NAKSHATRA ASPIRE, NAROL ASLALI HIGHWAY, NAROL, AHMEDABAD- 382440
6	<b>MR BHALGAMIA MEHUL RASIKBHAI (Borrower) MRS BHALGAMIA KOKILABEN RASIKBHAI (Co-Borrower)</b>	<b>Rs. 87,235/-and Rs. 1,16,974/- respectively dues as on 30-Jun-25*</b>	<b>05-Aug-2025</b>	FLAT-E-502, FLOOR-5 SHREE RADHE KRISHNA HERITAGE 2 BLK E, PLOT FF. 179, S NO 1225, TP. 113, OPP. RADHE KRISHNA HERITAGE, S/P RING ROAD, AHMEDABAD-382315
7	<b>MRS PATEL SEJAL MANISH (Borrower) MR PATEL MANISHBHAI NAGJIBHAI (Co-Borrower)</b>	<b>Rs. 87,235/-and Rs. 26,29,717/- respectively dues as 30-Jun-25*</b>	<b>02-Aug-2025</b>	UNIT-168, SHREE VILLA, S NO 375/P1, OPP. TIRUPATI RAJ TENAMENT, NR. SHAILIJA BUNGLOWS, AMBAJI NAGAR ROAD, PATAN- 360530

\*with further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realization. If the said Borrowers shall fail to make payment to HDFC as aforesaid, then HDFC shall proceed against the above Secured Asset(s) / Immovable Property (ies) under Section 13 (4) of the said Act and the applicable Rules entirely at the risk of the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) as to the costs and consequences. The said Borrower (s) / Legal Heir(s) / Legal Representative(s) are prohibited under the said Act to transfer the aforesaid Secured Asset (s) / Immovable Property (ies), whether by way of sale, lease or otherwise without the prior written consent of HDFC. Any person who contravenes or abets contravention of the provisions of the Act or Rules made thereunder shall be liable for imprisonment and/or penalty as provided under the Act.

**Date : 18.08.2025**  
**Place : Gujarat**  
**For HDFC Bank Ltd.**  
**Sd/-**  
**Authorised Officer,**

**Regd Office: HDFC Bank Ltd. HDF Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013.**  
**CIN: L65920MH1994PLC080618 Website: [www.hdfcbank.com](http://www.hdfcbank.com)**



**The Mehsana Urban Co-op. Bank Ltd., Mehsana**  
(Multi State Scheduled Bank)  
Head Office : Corporate Building, Highway, Mehsana-384002. Phone No. : (02762) 257233, 257234

**DEMAND NOTICE**  
**NOTICE U/S 13(2) OF SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 (HERE IN AFTER CALLED 'ACT ')**  
Notice is hereby given to the Borrower as per the list below, have defaulted in the repayment of principal and interest of the loan facilities obtained by them from Bank and the loans have been classified as Non-Performing Assets (NPA). The notices were issued to Borrowers and its Guarantors under Section 13(2) of Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 on their last known address, but notices issued to the following Borrowers/Guarantors have been returned/unserved and as such Borrowers/Guarantors are hereby informed by way of this public notice.

Sr. No.	Name and Address of Borrower	Name and Address of Guarantor	Date of Notice	Date of NPA	Amount outstanding	Details of Properties/Address of Secured Assets to be Enforced
1	Daluben Hasmukhbhai Valmiki Quarter No. G/8, Shri Vagad Welfare Society, Hospital, NH-8, Ta-Bhachau, Di-Kutch.	Manishbhai Aravindbhai Solanki Ramdev Nagar, 8/h Railway Station, Ta-Anjar, Dist-Kutch.	24-07-2025	14-08-2023	Rs.5,63,977 (Rupees Five Lakh Sixty three thousand nine hundred seventy seven only) up to 14-07-2025	Property in the name of Daluben Hasmukhbhai Valmiki All that N.A. Residential land admeasuring area of 42.575 Sq.Mtrs. Or there about for plot bearing Sub Plot No. 163 to 168/C, for Residential Purpose, Main Plot No. 163 to 168, under Revenue Survey No. 330/paiki 1, 330/paiki 2, 331/paiki 1 and 332/1/paiki 1, situated at Varsamed, Taluka-Anjar-Kutch, in Sub-Registration District of Anjar, and District of Kutch, and bounded : East: 7.50 Mtr wide Road, West: Sub Plot No. 169 to 174/C, North: Sub Plot No. 163 to 168/D, South: Sub Plot No. 163 to 168/B.
2	Ramilaben Manubhai Bhangi Manubhai Maghabhai Bhangi Valmiki Vas, B/h Kalkalhasa, Radhanpur, Di-Patan.	Santok Singh Plot No. 232, First Floor, Sector 1/A, Gandhidham, Kutch.	24-07-2025	21-10-2023	Rs.5,14,035/- (Rupees Five lacs Fourteen thousand thirty five only) up to 21-07-2025	Property in the name of Ramilaben Manubhai Bhangi All that N.A. Residential land admeasuring area of 43.875 Sq.Mtrs. Or there about for plot bearing Sub Plot No. 141-B, for Residential Purpose, Main Plot No. 141, under Revenue Survey No. 330/paiki 1, 330/paiki 2, 331/paiki 1 and 332/1/paiki 1, situated at Varsamed, Taluka-Anjar-Kutch, in Sub-Registration District of Anjar, and District of Kutch, and bounded East: 7.50 Mtr wide Road , West: Sub Plot No. 160-B , North: Sub Plot No. 140-A, South: Sub Plot No. 141-A.

The steps are being taken for substituted service of notice. The above Borrowers/Guarantors are hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice, failing which further steps will be taken after expiry of 60 days from the date of this notice under subsection (4) of Section 13 of Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.  
**The attention is invited to provisions of subsection (8) of section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.**  
**Sd/-**  
**Date: 18.08.2025**  
**Place: Mehvana**  
**Authorized Officer,**  
**The Mehvana Urban Co Op Bank Ltd.**



**Shaily Engineering Plastics Limited**  
Engineering Plastics Ltd

**CIN : L51900GJ1980PLC065554**  
**Regd. Office :** Survey No. 364 / 366, At & PO : Rania, Taluka : Savli, Dist. Vadodara - 391 780, India.  
**Phone :** 91 7574805122 / 7574805181 **E-mail :** [investors@shaily.com](mailto:investors@shaily.com) **Visit us :** [www.shaily.com](http://www.shaily.com)

**NOTICE OF THE 45<sup>th</sup> ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION**

- The Forty-fifth (45<sup>th</sup>) Annual General Meeting (AGM) of Shaily Engineering Plastics Limited (the 'Company') will be held through Video Conferencing (VC) / Other Audio-Visual Means (OAVM) on Saturday, 27<sup>th</sup> September 2025 at 10:30 A.M. (IST), in compliance with the applicable provisions of the Companies Act, 2013 (the 'Act') and the relevant Rules made thereunder and the Securities and Exchange Board of India ('SEBI') (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015 ('Listing Regulations'), as amended from time to time, read with latest General Circular No. 09/2024 dated 19<sup>th</sup> September 2024 and all other applicable circulars, if any, issued by the Ministry of Corporate Affairs ('MCA') from time to time and Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CI/R/2024/133 dated 3rd October 2024 issued by SEBI (hereinafter collectively referred to as 'the Circulars') to transact the business set out in the Notice calling the 45<sup>th</sup> AGM.
- In compliance with the aforesaid Circulars, Notice of the 45<sup>th</sup> AGM along with the Annual Report for the Financial Year 2024-25, will be sent only through electronic mode to those Members whose email addresses are registered with the Company / Depositories. Members may note that the said Notice and Annual Report will also be available on the Company's website [www.shaily.com](http://www.shaily.com) websites of the Stock Exchanges i.e. [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) respectively and on the



